



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૩/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૭૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૫ કેસ કરી, ૫૪ વ્યક્તિઓને ઝડપી, ૨૨૦ લીટર દેશી દારૂ, ૧૦૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૩ ક્વોટર ઇંગ્લીશ દારૂ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૪ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૮,૪૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૭૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૬૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૫૭૩/૧૯

નરોડા : કૈલાશબહેન ઉર્ફે પિંક્કીબેન વા/ઓ દેવીલાલ કુમાવત (ઉ.વ.૩૫)(રહે.સિલ્વર હેબીટેટ સોસાયટી રોયલ હોટલની બાજુમા એસ.પી.રિંગ રોડ વસ્ત્રાલ) તા.૨૯/૦૩/૨૦૧૯ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે નરોડા ગામ પંચાયત પાસે થી ચાલતા પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ કૈલાશબહેન ના ગળામાંથી સોનાનું પેડલ સહીતનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મતાનું ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગે કૈલાશબહેન કુમાવતે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

ભુલથી એસીડ પી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૭૪/૧૯

રામોલ: રેણુકાબહેન મુન્નાભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૫) (રહે. સુમીનનગર વસ્ત્રાલ) એ તા.૧૭/૩/૧૯ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે શરદી ખાસીની દવા લેવાને બદલે ભુલથી એસીડની બોટલમાંથી એસીડ પી લીધું હતું. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૯/૩/૧૯ કલાક ૬/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ઓ.ભરવાડ ચલાવે છે.

અમરાઇવાડી: મનોજ પ્રભુદાસ વણજારા (ઉ.વ.૨૯) (રહે. બજરંગના છાપરાં સુખરામપુરા પોસ્ટ ઓફીસ સામે ગુલાબનગર રોડ) એ બેકારીથી કંટાળી તા.૨૯/૩/૧૯ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મુકેશભાઈ જીવણભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.